

17 એપ્રિલ 2018

ઉમેદવાર નામાંકનો અને તૃતીય પક્ષ જાહેરાતકર્તા નોંધણીઓ બ્રમ્પટન નગરપાલિકાની 2018 ચૂંટણી માટે મે 1ના રોજ પ્રારંભ

બ્રમ્પટન, ઓન્ટેરિયો – 01 મે 2018ના રોજ 2018 નગરપાલિકાની ચૂંટણી માટે સીટી ઓફ બ્રમ્પટન ક્લર્કનું કાર્યાલય ઉમેદવાર નામાંકનો અને તૃતીય પક્ષ જાહેરાતકર્તા નોંધણીઓ સ્વીકારવાનો પ્રારંભ કરશે.

ઉમેદવારોના નામાંકનનો સમયગાળો 01 મે 2018ના દિને શરૂ થઈને 27 જુલાઈ 2018ના દિને બપોરે 2 વાગ્યે સમાપ્ત થશે.

તૃતીય પક્ષ જાહેરાતકર્તાઓની નોંધણીનો સમયગાળો 01 મે 2018ના રોજ શરૂ થઈને 19 ઓક્ટોબર 2018ના રોજ સમાપ્ત થશે.

ઉમેદવારો અને તૃતીય પક્ષ જાહેરાતકર્તા માટેના સામાન્ય દિશાનિર્દેશો વિષયક એક પ્રસ્તૂતિ સીટીની [website](#) પર ઉપલબ્ધ છે.

ઉમેદવારો

સીટી નીચે આપેલ હોદ્દાઓ માટે નામાંકનો સ્વીકારશે:

- નગરપતિ (મેયર)
- પ્રાદેશિક પરિષદ સભ્ય (રીજનલ કાઉન્સિલર)
- શહેર પરિષદ સભ્ય (સીટી કાઉન્સિલર)
- નીચે આપેલ મંડળો માટે શાળા મંડળ ટ્રસ્ટી (સ્કૂલ બોર્ડ ટ્રસ્ટી):
 - પીલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ
 - ડફેરિન-પીલ કેથોલિક ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ
 - કૉસેઈ સ્કૉલે કેથોલિક મૉએવોનિર (અગાઉનું કૉસેઈ સ્કૉલે દ દીસ્ટ્રીક્ટ કેથોલિક સાંથો-સુઈદ)

સ્કૂલ બોર્ડ ટ્રસ્ટી, કોન્સિલ સ્કોલેર વિઆમોન્દના હોદ્દા માટેના નામાંકનો કાર્યાલયના નિયમિત સમય દરમિયાન સીટી ઓફ મિસિસોગા, 300 સીટી સેન્ટર ડ્રાઈવ, મિસિસોગા દ્વારા સ્વીકારવામાં આવશે.

2018માં પ્રથમ વખત, રિજન ઓફ પીલ ચેર સામાન્ય મત દ્વારા ચુંટવામાં આવશે. આ હોદ્દા માટેના નામાંકનો રિજન ઓફ પીલ, 10 પીલ સેન્ટર ડ્રાઈવ, બ્રમ્પટન, દ્વારા કાર્યાલયના નિયમિત સમય દરમિયાન સ્વીકારાશે.

ઉમેદવારો માટેના ફોર્મ્સ અને માહિતી પેકેજ હવે ઓનલાઈન ઉપલબ્ધ છે અને હાર્ડકોપિઝ એટલેકે કાગળ પર છાપેલ નકલો ટૂંક સમયમાં બ્રમ્પટન સીટી હોલ ખાતે સ્થિત સીટી ક્લર્કના કાર્યાલય પર ઉપલબ્ધ થશે. ફોર્મ પોતે (અથવા એજન્ટ દ્વારા) કાર્યાલયના નિયમિત સમય દરમિયાન સવારે 8:30 – સાંજે 4:30 વચ્ચે અઠવાડિયાના દિવસોમાં મે 1થી શરૂ કરી 27 જુલાઈ 2018ના રોજ બપોરે 2 સુધી ફાઈલ કરી શકાશે.

ફાઇલ કરતી વખતે ફી (\$200.00 મેયર માટે અને અન્ય તમામ હોદ્દાઓ માટે \$100.00) રોકડા, ડેબિટકાર્ડ, પ્રમાણિત ચેક અથવા મની ઓર્ડર દ્વારા ચૂકવવાપાત્ર છે. અરજદારોએ નામ અને માન્ય સરનામાના પુરાવા પૂરા પાડવાના રહેશે. ફક્ત મૂળ દસ્તાવેજો સ્વીકારાશે; ફેક્સ અથવા અન્ય ઇલેક્ટ્રોનિક સંસ્કરણોને મંજૂરી નથી. તમામ સંબંધિત ઉમેદવારોએ તેમના નામાંકન પત્ર અને નામાંકનને સમર્થનનું પત્રક (એન્ડોર્સમેન્ટ ઓફ નોમિનેશન ફોર્મ) ઝુંબેશના કોઈ પણ ફાળા પ્રાપ્ત કરતા પહેલા અથવા ચૂંટણી હેતુઓસર કોઈ પણ ભંડોળ ખર્ચતા પહેલા ફાઇલ કરી દેવાનું રહેશે. સ્કૂલ બોર્ડના ટ્રસ્ટી માટેના ઉમેદવારોએ એન્ડોર્સમેન્ટ ઓફ નોમિનેશન ફોર્મ ફાઇલ કરવું આવશ્યક નથી.

તૃતીય પક્ષ જાહેરાતકર્તાઓ

2018 નગરપાલિકાની ચૂંટણીમાં નવું એટલે તૃતીય પક્ષ જાહેરાતકર્તાઓની નોંધણી. કોઈપણ વ્યક્તિ, કોર્પોરેશન કે ટ્રેડ યુનિયન જેઓ પ્રસારણ, પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અથવા અન્ય માધ્યમમાં કોઈ ઉમેદવારને પ્રોત્સાહિત કરવા, ટેકો આપવા અથવા વિરોધ કરવા માટે જાહેરાત કરવા ઈચ્છતા હોય તેઓએ સીટીમાં નોંધણી કરાવવી આવશ્યક છે.

નોંધણી ફોર્મ્સ અને માહિતી પેકેજ હવે ઓનલાઇન ઉપલબ્ધ છે અને હાર્ડકોપિઝ એટલેકે કાગળ પર છાપેલ નકલો ટૂંક સમયમાં બ્રમ્પટન સીટી હોલ ખાતે સ્થિત સીટી ક્લર્કના કાર્યાલય પર ઉપલબ્ધ થશે. નોંધણી જાતે (અથવા એજન્ટ દ્વારા) કાર્યાલયના નિયમિત સમય દરમિયાન સવારે 8:30 – સાંજે 4:30 વચ્ચે અઠવાડિયાના દિવસોમાં મે 1થી શરૂ કરી 19 ઓક્ટોબર 2018 સુધી ફાઇલ કરી શકાશે. અરજદારોએ ઓળખ પૂરી પાડવાની રહેશે. ફક્ત મૂળ દસ્તાવેજો સ્વીકારાશે; ફેક્સ અથવા અન્ય ઇલેક્ટ્રોનિક સંસ્કરણોને મંજૂરી નથી. તૃતીય પક્ષ જાહેરાતકર્તાઓએ તેમના નોંધણીના દસ્તાવેજો ઝુંબેશના કોઈ પણ ફાળા પ્રાપ્ત કરતા પહેલા અથવા ચૂંટણી હેતુઓસર કોઈ પણ ભંડોળ ખર્ચતા પહેલા ફાઇલ કરી દેવાના રહેશે.

નામાંકન થયેલ ઉમેદવારો અને નોંધણી થયેલ તૃતીય પક્ષ જાહેરાતકર્તાઓની યાદી નિયમિતરૂપે અદ્યતન થતી રહેશે અને તે www.brampton.ca/BramptonVotes પર ઉપલબ્ધ છે.

ક્વોટ:

"મ્યુનિસિપલ ઇલેક્શન્સ એક્ટમાં તાજેતરમાં થયેલ ફેરફારોમાં ઉમેદવારો માટે પહેલા કરતા ટૂંકા નામાંકન સમયગાળા અને તૃતીય પક્ષ જાહેરાત નિયમોના ઉમેરાનો સમાવેશ થાય છે. તે અગત્યનું છે કે સંબંધિત ઉમેદવારો અને તૃતીય પક્ષ જાહેરાતકર્તાઓ કાયદા અને ચૂંટણી ઝુંબેશ દરમિયાન તેમની પાસેથી શું અપેક્ષાઓ હશે તે વિશે પોતે વાકેફ થઈ જાય.

- પીટર કે, સીટી ક્લર્ક એન્ડ રિટર્નિંગ ઓફિસર

વધુ માહિતી માટે, અહીં આપેલ ચૂંટણી પાનની મુલાકાત લેશો www.brampton.ca/BramptonVotes અથવા 311 પર કોલ કરશો.

બ્રમ્પટન વિશાળ આયોજનો વિશે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોક્સ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તાણખો યાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર

કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મીડિયા સંપર્ક (MEDIA CONTACT)

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા કોર્ડિનેટર (Media Coordinator)

સીટી ઓફ બ્રામ્પટન (City of Brampton)

905.874.3654 | natalie.stogdill@brampton.ca